

BBC LEARNING ENGLISH

English Expressions

Full-on



This is not a word-for-word transcript

પ્રેઝન્ટર

હેલ્લો એન્ડ વેલકમ, English Expressionsમાં આપનું સ્વાગત છે. હું છું રિષી....અને આજે આપણે વાત કરીશું 'full on' એટલે 'તીવ્ર અથવા ભારે અનુભવ' વિશે.

મિત્રો, અંગ્રેજીમાં એક્સપ્રેશન એટલે કે અભિવ્યક્તિના ભાગરૂપે બોલવામાં આવતાં 'full on' વિશે તમે કેટલું જાણો છો. ડોન્ટ વરી....હું તમને સમજાવું.

હેરી અને ફ્રેફેઈ પોતાના 'weekends' એટલે શનિવાર અને રવિવારની રજાઓ વિશે ચર્ચા કરી રહ્યાં છે. તમને શું લાગે છે ફેન્ડસ, બન્ને માંથી કોનો 'weekend' વધારે આનંદદાયક હતો? કોનો 'weekend' વધારે 'intense' એટલે જોશીલો હતો. જાણવા સાંભળો બંનેને.

Harry

And the expression we are going to look at today which we hear a lot in colloquial speech is 'full-on'. So, Feifei – did you have a good weekend?

Feifei

It was quiet. I stayed home most of the time. I watched a couple of old, black and white films with my grandmother on Sunday. That was the highlight. How about you?

Harry

Well, your weekend sounds quite... relaxed. Well, my weekend wasn't like your weekend at all. I went to the launch party of a new bar on Friday – that was quite a night! Then on Saturday my friends took me to a night club that went on until morning!

પ્રેઝન્ટર

એવું લાગે છે કે હેરીનો વીકએન્ડ વધારે મજેદાર અને જોશીલો હતો. ફ્રેફેઈએ પોતાની દાદી સાથે ફિલ્મો જોઈ જ્યારે હેરી શુક્રવારે 'bar' માં ગયો અને શનિવારે 'clubbing' માટે ગયો. મિત્રો, 'bar' ને ગુજરાતીમાં 'બાર' જ કહીશું. એ એક એવી જગ્યા છે જ્યાં માદક પીણું પીરસવામાં આવે છે. 'clubbing' એટલે નાઈટક્લબમાં જઈને સમય પસાર કરવો. What do you think FeiFei will think of Harry's night out?

Feifei

Wow! That sounds exciting. Clubbing though - aren't you a bit old for that sort of thing?

Harry

No, I'm not too old, but to be honest – it was a bit full-on.

Feifei

Full-on? What do you mean?

Harry

Well, the music, the dancing, the drinking, the energy. It was very intense. I'm not old, but I'm not as young as I was.

Feifei

Right. So full-on means it was very intense.

Harry

Yeah. I think I'll need a few days to recover; it was so full-on.

Feifei

What else can be full-on?

Harry

Some people are a bit full-on. A bit extreme. Not relaxing.

Feifei

I know what you mean. Sarah's a bit full-on isn't she?

Harry

Yes, she scares me. She stands so close when she talks to me and stares straight into my eyes. Work can also be full-on when it's busy.

Feifei

Work has been a bit full on lately hasn't it. We've had to do loads of overtime to get the new project finished.

Harry

It has been full-on, yes.

પ્રેઝન્ટર

લાગે છે હેરીનો વીકએન્ડ એકદમ 'full-on' હતો. 'full-on' એ બે શબ્દોથી બનેલો શબ્દ છે. 'full' એટલે સંપૂર્ણ અને 'on' એટલે ઉપર. 'full' શબ્દ આત્યંતિક અને જોશીલી સ્થિતિ માટે ઉપયોગમાં લેવામાં આવે છે.

મિત્રો, જ્યારે પરિસ્થિતિ અથવા વ્યક્તિ એટલો તીવ્ર અને જોશીલો હોય કે જેનાથી મુશ્કેલી ઉભી થઈ શકે ત્યારે 'full-on' એ નકારાત્મક રીતે ઉપયોગમાં લેવાય છે. ફેફેઈ સારાહ માટે 'full-on' શબ્દનો ઉપયોગ કરે છે. જ્યારે કોઈ એકદમ નજીક આવીને ઉભું રહે અથવા એકધારી રીતે ધૂરે છે ત્યારે એ સ્થિતિ ડરાવનારી અથવા 'full-on' હશે.

હજુ કનફ્યૂઝન છે? ચાલો થોડાં ઉદાહરણો સાંભળીએ.

Examples

A: Have a good holiday?

B: To be honest, not really. We were up at 6am every day to get as much sightseeing done as possible and didn't get to bed till midnight. It was so full-on. I feel like I need another holiday.

I really don't like children's parties. All those excited, screaming kids. It's too full-on.

London's too full-on. I need to move to the countryside.

Feifei

Well, if you want a more relaxing weekend next time, come and watch some films with me and my grandmother. It's really laid back.

Harry

That sounds a lot less full-on. I'll do that.

પ્રેઝન્ટર

બની શકે હેરી બીજા વીકએન્ડમાં ઓછો 'full-on' નો અનુભવ કરે અને વધારે આરામ કરે. તમારા વિશે જણાવો મિત્રો? શું જ્યારે સ્થિતિ 'full-on' હોય તો તમને વધારે મઝા આવશે કે ન હોય ત્યારે? શું તમે કોઈ એવા વ્યક્તિને ઓળખો છો જે 'full-on' થયો હોય? શું તમે ક્યારેય 'full-on' થયા છો?

આવા જ બીજા રસપ્રદ ટોપિક્સ સાથે ફરીથી મળીશું English Expressions માં. ત્યાં સુધી..Bye!